https://archive.org/details/bk1000/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar

ઝોનોમાં આવતી ઘટક સમાજોએ પાળવાના નિતી નિયમો.

realpatidar.com

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે મળેલ પંચમ જ્ઞાતિ અધિવેશનમાં જ્ઞાતિની સનાતની સ્પષ્ટ નીતીની જાહેરાત થયા બાદ ઝોન તથા ઘટક સમાજોએ બનાવેલ ધારાધોરણ અને રીતરિવાજો ભિન્ન ભિન હોવાથી ઉભી થતી મુશ્કેલીઓને ધ્યાને લઈ સમાજોમાં એકવાયતા રહે તે માટે તા. ૨૧.૦૭.૨૦૧૩ ના અમદાવાદ મુકામે કેન્દ્રીય [illegible]ના પ્રમુખશ્રી ગંગારામભાઈ હીરાલાલ સાંખલાના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય સમાજના ટ્રસ્ટીશ્રીઓ, [illegible]શ્રીઓ, ૨૯ ઝોન પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, ઝોનપ્રતિનીધીશ્રીઓ તથા યુવાસંઘના [illegible]ોની સાથે એક સંયુકત મીટીંગ મળેલ. આ મીટીંગમાં દરેક ઝોનના બનાવેલ ધારાધોરણ ઉપર ચર્ચા વિચારણા કર્યા બાદ જુના સંબંધો જાળવી રાખવા અને નવા સંબંધો ફકત સનાતની સમાજમાંજ કરવા બાબતે સર્વની સહમતી થયા બાદ નિચે લખ્યા મુજબના ઠરાવ પાસ કરવામાં આવ્યા. આ ઠરાવોની બે વર્ષ બાદ ફરીથી સમિક્ષા કરવામાં આવશે એવું નકકી કરવામાં આવ્યું.

Full Library on https://realpatidar.com/library

ઠરાવ નં.૧) આપણી કેન્દ્રીય સમાજની સ્થાપના એવા વડીલો દ્વારા કરવામાં આવી હતી કે જેમણે પીરાણા સતપંથ ધર્મનો સદંતર ત્યાગ કરી મુળ સનાતન હિન્દુ ધર્મનો અંગીકાર કર્યો હતો.તેથી નિઃશક પણે પુરવાર થાય છે કે આપણી કેન્દ્રીય સમાજ સનાતની વિચાર ધરાવતી સમાજ છે અને તેનો ધર્મ સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે.

ઠરાવ નં.૨) શ્રીસમાજની સ્થાપક વડવાઓના અભિગમને અનુસરી આ સમાજ મુળભૂત હિન્દુ સનાતનવિચારધારાથી ભટકી ગયેલ જ્ઞાતિજનોને હિન્દુ સનાતન વિચારધારામાં ભેળવવાના પ્રયાસો કરશે. શ્રીસમાજનો હિન્દુ પરંપરાને જાળવીને હમેશને માટે કાર્ય કરવાનો આદેશ હતો તેથી આ સમાજ તેજ વિચારધારા પર કાર્ય કરશે અને સમાજમાં સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર–પ્રસાર કરશે.

ઠરાવ નં.૩) અત્યાર સુધી કેન્દ્રીય સમાજ દ્વારા જ્ઞાતિના પાંચ અધિવેશનો બોલાવવામાં આવ્યા છે. તેમાં જ્ઞાતિના રીતરિવાજોને લગતા ૧૭ ઠરાવો અને બાહય આચરણ અંગેનો ઠરાવ ૧૮ મો અને સામાજીક તેમજ ધાર્મિક પ્રશ્નોના નિવારણ માટે ઠરાવ ૧૯ મો એમ કુલ ૧૯ ઠરાવો પસાર કરેલા છે તે બધા ઠરાવો પાળવા અત્યંત જરૂરી છે. તેમાં ઠરાવ ૧૮ અને ૧૯ વધારે અગત્યના લાગતા તેનું દરેક જ્ઞાતિજનઓએ ચુસ્તપણે પાલન કરવું અને કરાવવું ખુબજ જરૂરી બને છે. સમાજમાં એકજ આચાર અને વિચાર કાયમ રહે એકજ રીતરિવાજોનું અને સનાતન હિન્દુ ધર્મનું ચુસ્તપણે પાલન થાય તે અત્યંત જશ્રી છે.

ઉપરોકત નિયમોનો ભંગ અથવા બહીષ્કાર કરનાર વ્યકિતનું સભ્યપદ દરેક સમાજોએ પોતાના બંધારણને આધીન રહીને રદ કરવાનું રહેશે અને સામાજીક અથવા ધાર્મિક કે વ્યવહારિક પ્રસંગે તેમને આમંત્રિત કરવાના રહેશે નહી. આ અંગેની જવાબદારી ભારતભરના તમામ ઝોન અને તેની ઘટક સમાજોને સોપવામાં આવે છે.

ઠરાવ નં.૪) જ્ઞાતિના અધિવેશનમાં બહુમતે કે સર્વાનુંમતે પસાર કરવામાં આવેલ જ્ઞાતિના નિતીનિયમોનો વિરોધ કરવાવાળાને જ્ઞાતિજન તરીકે કયારે પણ સ્વીકારવામાં આવશે નહી. અત્યાર સુધીના પાંચ અધિવેશનમાં હિન્દુ સનાતન વૈદિક ધર્મમાં માનવાવાળા લોકો જ્ઞાતિનાં નિતીનિયમોને નહી પાળવાની જાહેરાત સાથે દંગાફસાદ કરતા આવ્યા છે તેવા લોકો ને હવે આપણી કેન્દ્રીય સમાજમાં સમાવેશ કરવો કે નહી તેનો નિર્ણય કેન્દ્રીય સમાજને કરવો પડશે.

ઠરાવ નં.૫) સમાજના શૈક્ષણિક શંકુલો તથા હોસ્ટેલોમાં કયારે પણ સંપ્રદાય આધારીત ભેદભાવ રાખવામાં આવતો નથી. પરંતુ શંકુલોમાં કોઈ પણ વિદ્યાર્થીને એડમીશન આપવાનો અધિકાર કેન્દ્રીય સમાજનો રહેશે અને તે મુજબ સમાજના દરેક શંકુલોની સંચાલન સમિતિને કાર્ય કરવાનું રહેશે.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1000/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 2.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

https://archive.org/details/bk1000/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.20 15:54:10 +05'30'

ઝોનોમાં આવતી ઘટક સમાજોએ પાળવાના નિતી નિયમો.

realpatidar.com

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે મળેલ પંચમ જ્ઞાતિ અધિવેશનમાં જ્ઞાતિની સનાતની સ્પષ્ટ નીતીની જાહેરાત થયા બાદ ઝોન તથા ઘટક સમાજોએ બનાવેલ ધારાધોરણ અને રીતરિવાજો ભિન્ન ભિન હોવાથી ઉભી થતી મુશ્કેલીઓને ધ્યાને લઇ સમાજોમાં એકવાયતા રહે તે માટે તા. ૨૧.૦૭.૨૦૧૩ ના અમદાવાદ મુકામે કેન્દ્રીય સમાર્જના પ્રમુખશ્રી ગંગારામભાઇ હીરાલાલ સાંખલાના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય સમાજના ટ્રસ્ટીશ્રીઓ, હોદેદારશ્રીઓ, ૨૯ ઝોન પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, ઝોનપ્રતિનીધીશ્રીઓ તથા યુવાસંઘના હોદેદારોની સાથે એક સંયુકત મીટીંગ મળેલ. આ મીટીંગમાં દરેક ઝોનના બનાવેલ ધારાધોરણ ઉપર ચર્ચા વિચારણા કર્યા બાદ જુના સંબંધો જાળવી રાખવા અને નવા સંબંધો ફકત સનાતની સમાજમાંજ કરવા બાબતે સર્વની સહમતી થયા બાદ નિચે લખ્યા મુજબના ઠરાવ પાસ કરવામાં આવ્યા. આ ઠરાવોની બે વર્ષ બાદ ફરીથી સમિક્ષા કરવામાં આવશે એવું નકકી કરવામાં આવ્યું.

ઠરાવ નં.૧) આપણી કેન્દ્રીય સમાજની સ્થાપના એવા વડીલો દ્વારા કરવામાં આવી હતી કે જેમણે પીરાણા સતપંથ ધર્મનો સદંતર ત્યાગ કરી મુળ સનાતન હિન્દુ ધર્મનો અંગીકાર કર્યો હતો.તેથી નિઃશક પણે પુરવાર થાય છે કે આપણી કેન્દ્રીય સમાજ સનાતની વિચાર ધરાવતી સમાજ છે અને તેનો ધર્મ સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે.

ઠરાવ નં.૨) શ્રીસમાજની સ્થાપક વડવાઓના અભિગમને અનુસરી આ સમાજ મુળભૂત હિન્દુ સનાતનવિચારધારાથી ભટકી ગયેલ જ્ઞાતિજનોને હિન્દુ સનાતન વિચારધારામાં ભેળવવાના પ્રયાસો કરશે. શ્રીસમાજનો હિન્દુ પરંપરાને જાળવીને હમેશને માટે કાર્ય કરવાનો આદેશ હતો તેથી આ સમાજ તેજ વિચારધારા પર કાર્ય કરશે અને સમાજમાં સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર–પ્રસાર કરશે.

ઠરાવ નં.૩) અત્યાર સુધી કેન્દ્રીય સમાજ દ્વારા જ્ઞાતિના પાંચ અધિવેશનો બોલાવવામાં આવ્યા છે. તેમાં જ્ઞાતિના રીતરિવાજોને લગતા ૧૭ ઠરાવો અને બાહય આચરણ અંગેનો ઠરાવ ૧૮ મો અને સામાજીક તેમજ ધાર્મિક પ્રશ્નોના નિવારણ માટે ઠરાવ ૧૯ મો એમ કુલ ૧૯ ઠરાવો પસાર કરેલા છે તે બધા ઠરાવો પાળવા અત્યંત જરૂરી છે. તેમાં ઠરાવ ૧૮ અને ૧૯ વધારે અગત્યના લાગતા તેનું દરેક જ્ઞાતિજનઓએ ચુસ્તપણે પાલન કરવું અને કરાવવું ખુબજ જરૂરી બને છે. સમાજમાં એકજ આચાર અને વિચાર કાયમ રહે એકજ રીતરિવાજોનું અને સનાતન હિન્દુ ધર્મનું ચુસ્તપણે પાલન થાય તે અત્યંત જરૂરી છે.

ઉપરોકત નિયમોનો ભંગ અથવા બહીષ્કાર કરનાર વ્યકિતનું સભ્યપદ દરેક સમાજોએ પોતાના બંધારણને આધીન રહીને રદ કરવાનું રહેશે અને સામાજીક અથવા ધાર્મિક કે વ્યવહારિક પ્રસંગે તેમને આમંત્રિત કરવાના રહેશે નહી. આ અંગેની જવાબદારી ભારતભરના તમામ ઝોન અને તેની ઘટક સમાજોને સોપવામાં આવે છે.

ઠરાવ નં.૪) જ્ઞાતિના અધિવેશનમાં બહુમતે કે સર્વાનુંમતે પસાર કરવામાં આવેલ જ્ઞાતિના નિતીનિયમોનો વિરોધ કરવાવાળાને જ્ઞાતિજન તરીકે કયારે પણ સ્વીકારવામાં આવશે નહી. અત્યાર સુધીના પાંચ અધિવેશનમાં હિન્દુ સનાતન વૈદિક ધર્મમાં માનવાવાળા લોકો જ્ઞાતિનાં નિતીનિયમોને નહી પાળવાની જાહેરાત સાથે દંગાફસાદ કરતા આવ્યા છે તેવા લોકો ને હવે આપણી કેન્દ્રીય સમાજમાં સમાવેશ કરવો કે નહી તેનો નિર્ણય કેન્દ્રીય સમાજને કરવો પડશે.

ઠરાવ નં.૫) સમાજના શૈક્ષણિક શંકુલો તથા હોસ્ટેલોમાં કયારે પણ સંપ્રદાય આધારીત ભેદભાવ રાખવામાં આવતો નથી. પરંતુ શંકુલોમાં કોઇ પણ વિદ્યાર્થીને એડમીશન આપવાનો અધિકાર કેન્દ્રીય સમાજનો રહેશે અને તે મુજબ સમાજના દરેક શંકુલોની સંચાલન સમિતિને કાર્ય કરવાનું રહેશે.

realpatidar.com

https://archive.org/details/bk1000/page/n3/mode/1up

ઠરાવ નં.૬) સભ્ય પદ : જ્ઞાતિ રચીત ઝોન તથા ઝોનોમાં આવતી સમાજોમાં સભ્ય બનવું હોય તેમણે કેન્દ્રીય સમાજ અથવા ઝોન દ્વારા બહાર પાડવામાં આવેલ સભ્ય બનવાનું ફોર્મ ભરવાનું રહેશે. કેન્દ્રીય સમાજના સભ્ય બનવા માટે જે તે કચ્છના ગામના સનાતની સમાજના પ્રમુખ/મંત્રીશ્રીના ભલામણ પત્રકની જરૂરત છે તેજ રીતે ઝોનમાં આવતી ઘટક સમાજના સભ્ય બનવા જે તે કચ્છના ગામની સનાતની સમાજના પ્રમુખ/મંત્રીશ્રીના ભલામણ પત્રકની જરૂરત રહેશે.

realpatidar.com

ઠરાવ નં.૭) જ્ઞાતિ રચીત ઝોન તથા ઘટક સમાજના દરેક સભ્યોનું બાહ્ય આચરણ હિન્દુ સનાતન વૈદિક ધર્મને અનુરૂપ હોવું જોઈએ. કેન્દ્રીય સમાજ દ્વારા બહાર પાડવામાં આવેલ જ્ઞાતિના રિતરીવાજોનું દરેક જ્ઞાતિજનોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ઠરાવ નં.૮) જ્ઞાતિ રચીત ઝોનો તથા ઝોનમાં આવતી સમાજના દરેક સભ્યોએ પોતાના દિકરા દિકરીના સગપણ કરવા પાટીદાર જ્ઞાતિમાં હિન્દુ સનાતન વૈદિક ધર્મને પાળતા હોય તથા ભારત ભરમાં ૨૯ ઝોનમાં આવતી ઘટક સમાજોના સભ્યો હોય તેવા કુટુંબ પરિવાર સાથે સગપણ કરવા. અન્યથા સગપણ કરવા નહી. જેથી સમાજમાં એકવાયતા જળવાય અને સમાજોમાં મતભેદ ઉભા ન થાય.

ઠરાવ નં.૯) આપણી જ્ઞાતિના પંચમ અધિવેશનમાં સનાતનની સ્પષ્ટ નીતી જાહેર કર્યા પહેલા દિકરા દિકરીના સગપણ હિન્દુ સનાતન વૈદિક ધર્મ પાળતા ન હોય તેવા પરિવારમાં થયેલ હોય તો તેવા સંબધો વિવેક બુદ્ધીથી જાળવી રાખવાના રહેશે. દિકરા કે દિકરીને ત્યાં લગ્ન વૈવારિક પ્રસંગ હોય તો મામેરા વિગેરે પ્રસંગે સીમીત સંખ્યામાં જવું. વધારેમાં વધારે દિકરીના દાદા કુટુંબના લોકોએ જવાનું રહેશે. દિકરીને ત્યાં મરણ પ્રસંગ હોય ત્યારે મરણની વિધિ સનાતન હિન્દુ વૈદિક ધર્મ મુજબ થયેલ હોય તો જ જવાનું રહેશે અન્યથા જવાનું રહેશે નહી.

ઠરાવ નં.૧૦) જ્ઞાતિ રચીત ઝોન તથા ઝોનમાં આવતી સમાજો દ્વારા ધાર્મિક તથા સામાજીક પ્રસંગો જેવા કે નવરાત્રી, જન્માષ્ટમી, સમુહ લગ્ન, સાતમ આઠમ વિગેરે કરવાના થાય તેવા પ્રસંગોમાં હિન્દુ સનાતન વૈદિક ધર્મ પાળતા હોય તેવા સભ્યો જ ભાગ લઈ સકશે. અન્યથા કોઈ પણ સભ્ય ભાગ લઈ શકશે નહી. જે સભ્યો હિન્દુ સનાતન વૈદિક ધર્મ પાળતા ન હોય તેવા સભ્યોને લગ્ન સહીતના કોઈ પણ પ્રસંગે સગા ભાઈને પણ આમંત્રણ આપવું નહી તેમજ સ્વીકારવું પણ નહી.

ઠરાવ નં.૧૧) આપણી જ્ઞાતિના બધા ગોત્રી પરિવારો હિન્દુ વૈદિક સનાતની વિચારધારાને માનતા થાય તે માટે બધા ગોત્રી પરિવારોના પ્રમુખશ્રીઓ તથા જવાબદાર સભ્યો સાથે એક ચિંતન બેઠકનું આયોજન કરી તેમાં ચર્ચા વિચારણા કરીને આખરી નિર્ણય લેવામાં આવશે.

ઉપરોક્ત લખ્યા મુજબ ૧૧ ઠરાવોનું જ્ઞાતિના દરેક ઝોનો તથા ઝોનોમાં આવતી દરેક સમાજોએ એકસરખા પાળવાના રહેશે જેથી ઝોનો તથા ઘટક સમાજોમાં નિતી નિયમો બાબતે એકવાતા જળવાઈ રહે.

realpatidar.com